

## ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર

### ઉમેદવાર જોગ અગત્યની જાહેરાત

૧. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર ધ્વારા વર્ષ-૨૦૨૨માં પંચાયત સેવા વર્ગ-૩ના કુલ-૧૭ સંવર્ગોની ૧૩૦૬૦ જેટલી જગ્યાઓ માટેની જાહેરાત પ્રસિધ્ધ કરી ઓનલાઇન અરજીઓ મેળવવામાં આવેલ છે. ઉપરોક્ત ૧૭ સંવર્ગો પૈકી અત્યાર સુધીમાં ૧૩ સંવર્ગોની સ્પર્ધાત્મક પરીક્ષા યોજાવવામાં આવેલ છે અને તે અન્વયે મંડળ ધ્વારા પરીણામલક્ષી આગળની કામગીરી વિવિધ તબક્કે પ્રગતિમાં છે. અમુક સંવર્ગોની આગળની પ્રક્રિયા પ્રોવીઝનલ આન્સર કી પ્રસિધ્ધ કરી ઉમેદવારો પાસેથી વાંધા-સુચનોના તબક્કે છે. જ્યારે અમુક સંવર્ગોમાં ઉમેદવારો પાસેથી મળેલ વાંધા-સૂચનો પરત્વે ફાઇનલ આન્સર કી પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. જ્યારે અમુક સંવર્ગોમાં પ્રોવીઝનલ રીઝલ્ટ અને પ્રોવીઝનલ મેરીટ લીસ્ટ પ્રસિધ્ધ કરી ઉમેદવારોના પ્રમાણપત્રો ચકાસણીની કામગીરી ચાલુમાં છે.
૨. કોઇપણ સંવર્ગની જાહેરાતની વિગતો, પ્રોવીઝનલ/ફાઇનલ આન્સર કી, પ્રોવીઝનલ રીઝલ્ટ, પ્રોવીઝનલ મેરીટ લીસ્ટ વિગેરે તમામ વિગતો માટે મંડળની અધિકૃત વેબસાઇટ <https://gpssb.gujarat.gov.in> ઉપર દર્શાવેલ વિગતો જ અધિકૃત છે, જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી છે.
૩. મંડળ ધ્વારા કરવામાં આવી રહેલી તમામ કામગીરી સંપૂર્ણપણે તટસ્થતાથી પારદર્શક રીતે અને ચોકસાઇપૂર્વક કરવામાં આવી રહેલ છે. અસામાજિક તથા લેભાગુ તત્વો ધ્વારા ઉમેદવારોને નોકરી અપવવાની ખોટી લાલચ આપી નાણાં ઉઘરાવવાની કોશિશ કરવામાં આવે તો, આવા તત્વોથી સાવચેત/સાવધાન રહેવા આથી દરેક ઉમેદવારોને જણાવવામાં આવે છે, તથા જો કોઇ ઇસમો ધ્વારા આવી પ્રવૃત્તિ કરાતી/કરાવાતી હોવાનું ધ્યાને આવે તો જાગૃત નાગરિક તરીકે આવી વ્યક્તિઓ સામે તાત્કાલિક કાયદેસરની ફોજદારી કાર્યવાહી કરવા સુચિત કરવામાં આવે છે તેમજ આવી વ્યક્તિઓ સામે લાંચ રૂઝત બ્યુરોના ટોલ ફ્રી નંબર-૧૮૦૦-૨૩૩-૪૪૪૪૪ અથવા ૧૦૬૪ ઉપર સંપર્ક કરવા અથવા નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા જણાવવામાં આવે છે.

તારીખ:- ૦૮/૦૬/૨૦૨૨